



પ્રાધ્યાપક અને વડા

# વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ

કૃષિ મહાવિદ્યાલય

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ

ફોન નં : (૦૨૮૫) ૨૬૭૨૦૮૦-૯૦, એક્સનં. ૩૦૩/૪૦૩/૩૫૫

E-mail :pathology@jau.in

## -:: વોક ઈન ઈન્ટરવ્યુ ::- (Revised)

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયંત્રણ હેઠળની આ કચેરીમાં મંજુર થયેલ યોજનાઓમાં નીચેની વિગતે કામચલાઉ ધોરણે, મુદતી સમય માટે જગ્યા ભરવા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને નિયત તારીખે અને સમયે હાજર રહેવા આમંત્રિત કરવામાં આવે છે.

ઈન્ટરવ્યુ તારીખ અને સમય: તા. ૨૮/૦૮/૨૦૧૭, મંગળવાર, સવારે ૮.૩૦ કલાકે

ઈન્ટરવ્યુ સ્થળ: વનસ્પતિ રોગ શાસ્ત્ર વિભાગ, કૃ.મ.વિ., જૂ.કૃ.યુ., જૂનાગઢ

ખાસ નોંધ: નિયત અરજી પત્રક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢની વેબ સાઈટ [www.jau.in](http://www.jau.in) પરથી ડાઉનલોડ કરવાનું રહેશે, જે ઈન્ટરવ્યુના સમયે આધારસહ જમા કરાવવાનું રહેશે, સવારે ૧૦.૩૦ કલાક પછી કોઈ અરજી પત્રક સ્વીકારવામાં આવશે નહિ.

યોજનાનું નામ: Evaluation of bioefficacy and phytotoxicity of BAS 750 02 F 400 g/l SC against rust, early leaf spot and late leaf spot diseases of Groundnut. (B. H. 18014-31)	
જગ્યાનું નામ	: ટેકનીકલ આસિસ્ટન્ટ
જગ્યાની સંખ્યા	: ૦૧ (એક)
શૈક્ષણિક લાયકાત	: M.Sc. (Microbiology) with First Class. અનુભવી ઉમેદવારોને અગ્રીમતા આપવામાં આવશે.
ઉમર વર્ષ (મહત્તમ)	: ૩૫ વર્ષ
મહેનતપાણું	: રૂ. ૧૬,૦૦૦/- ફિક્સ પ્રતિ માસ
યોજનાનો અંદાજિત સમય	: બે વર્ષ

યોજનાનું નામ: Evaluation of bioefficacy and phytotoxicity of BAS 751 04 F 240 g/l EC against rust, early leaf spot and late leaf spot diseases of Groundnut. (B. H. 18014-32)	
જગ્યાનું નામ	: ટેકનીકલ આસિસ્ટન્ટ
જગ્યાની સંખ્યા	: ૦૧ (એક)
શૈક્ષણિક લાયકાત	: B.Sc. (Microbiology). અનુભવી ઉમેદવારોને અગ્રીમતા આપવામાં આવશે.
ઉમર વર્ષ (મહત્તમ)	: ૩૫ વર્ષ
મહેનતપાણું	: રૂ. ૧૪,૦૦૦/- ફિક્સ પ્રતિ માસ
યોજનાનો અંદાજિત સમય	: બે વર્ષ

યોજનાનું નામ: Evaluation of Rallis fungicides pre mixture, Taqut 75 % WP for bio efficacy & Phytotoxicity on cumin. (B. H. 18014-33)	
જગ્યાનું નામ	: ટેકનીકલ આસિસ્ટન્ટ
જગ્યાની સંખ્યા	: ૦૧ (એક)
શૈક્ષણિક લાયકાત	: M.Sc. (Agri.) with Plant Pathology OR M.Sc. (Microbiology) with First class. અનુભવી ઉમેદવારોને અગ્રીમતા આપવામાં આવશે.
ઉમર વર્ષ (મહત્તમ)	: ૩૫ વર્ષ
મહેનતપાણું	: રૂ. ૧૬,૦૦૦/- ફિક્સ પ્રતિ માસ
યોજનાનો અંદાજિત સમય	: બે વર્ષ

યોજનાનું નામ: Efficacy evaluation of Nativo on cumin blight against alteranaria blight and powdery mildew disease in cumin. (B. H. 18014-34)	
જગ્યાનું નામ	: ટેકનીકલ આસિસ્ટન્ટ
જગ્યાની સંખ્યા	: ૦૧ (એક)
શૈક્ષણિક લાયકાત	: M.Sc. (Agri.) with Plant Pathology OR M.Sc. (Microbiology) with First class. અનુભવી ઉમેદવારોને અગ્રીમતા આપવામાં આવશે.
ઉમર વર્ષ (મહત્તમ)	: ૩૫ વર્ષ
મહેનતપાણું	: રૂ. ૧૬,૦૦૦/- ફિક્સ પ્રતિ માસ
યોજનાનો અંદાજિત સમય	: બે વર્ષ


\* કોઈ એક જગ્યા માટે દસથી વધારે ઉમેદવાર થશે તો લેખિત (MCQ) પરીક્ષાને આધારે અગ્રતાક્રમ મુજબ મોખીક ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને તેમની જન્મ તારીખ, જાતિ, શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરેના અસલ પ્રમાણપત્રો અને પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો જોડેલ અરજીપત્રક સાથે મૌખિક ઈન્ટરવ્યુ માટે નિયત તારીખે અને સમયે સ્વાખ્યે લાજર રહેવાનું રહેશે.

સદરહુ નિમાણુંક, ફક્ત કામચલાઉ ધોરણે, કોન્ટ્રક્ટ બેઈઝથી, યોજનાની અવધી પુરતી જ કરવાની છે. આ યોજનામાં નિમાણુંક પામેલ ઉમેદવારોને યુનિવર્સિટી કાયમી કર્મચારી તરીકે નિમાણુંક આપવા બંધાતી નથી તથા ઉમેદવાર નિમાણુંક મળ્યેથી યુનિવર્સિટી કર્મચારી તરીકે હકક હિસ્સો મેળવવા કોઈપણ પ્રકારના દાવા કરી શકશે નહિ. આવી નિમાણુંક પામનાર ઉમેદવારને યોજનાની અવધી સમાપ્ત થયેથી અથવા નિમાણુંક કરનાર અધિકારી તરફથી ગમે ત્યારે આ સેવામાંથી કોઈપણ જાતની નોટીસ કે વળતર આપ્યા વિના છુટા કરી શકાશે.

જૂનાગઢ

તા. ૨૩/૦૮/૨૦૧૭

  
(એલ. એફ. અકબરી)

જા. નં. જૂ.કૃ.યુ./કોલ/પીપીડી/ટિક-૩(૧)/૧૪૩૪ /૧૭, જૂનાગઢ.

તા. ૨૩/૦૮/૧૭

નકલ સવિનય રવાના:

માન. કુલપતિશ્રીના રહસ્ય સચિવશ્રી તરફ જન સારું.

નકલ જય ભારત સાથ રવાના:

૧. આ યુનિવર્સિટીના તમામ યુનિવર્સિટી અધિકારીશ્રીઓ તરફ E-mail થી જાણ સારું.
૨. કુલસચિવશ્રી, કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર/આણંદ/નવસારી તરફ બહોળી પ્રસિધ્ધી અર્થે.
૩. આચાર્યશ્રી, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ/ સરદાર કૃષિનગર/આણંદ/નવસારી કૃષિ યુનિવર્સિટી તરફ બહોળી પ્રસિધ્ધી અર્થે.
૪. કુલસચિવશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ તરફ બહોળી પ્રસિધ્ધી અર્થે.
૫. કુલસચિવશ્રી, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર તરફ બહોળી પ્રસિધ્ધી અર્થે.
૬. કુલસચિવશ્રી, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર તરફ બહોળી પ્રસિધ્ધી અર્થે.
૭. આચાર્યશ્રી, આત્મીય કોલેજ, કાલાવાડરોડ, રાજકોટ તરફ બહોળી પ્રસિધ્ધી અર્થે.

નકલ રવાના:

૧. આ યુનિવર્સિટીના તમામ વડાશ્રીઓ તરફ E-mail થી જાણ સારું.
૨. લાયબ્રેરીયનશ્રી, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ/સરદાર કૃષિનગર/આણંદ/નવસારી તરફ બહોળી પ્રસિધ્ધી અર્થે.
૩. નિયામકશ્રી, આઈ.ટી. સેલ, જૂ. કૃ. યુ. જૂનાગઢ તરફ બહોળી પ્રસિધ્ધી અર્થે વેબસાઈટ પર અપલોડ કરવા માટે.
૪. અત્રેની કચેરીની દરેક શાખાઓ તરફ જાણ સારું.



वनस्पति रोगशास्त्र विभाग  
कृषि महाविद्यालय  
गूनागढ कृषि युनिवर्सिटी, गूनागढ - ३६२ ००१  
फोन नं. (०२८५)२६७२०८० - ८० अकस्टे.३०३/४०३/३५५  
वोक ईन ईन्टरव्यू माटेनुं अरख पत्रक  
(ता. २८/०८/२०१७ ना अन्वये)

ताजेतरमां पडावेल  
पासपोर्ट साईजनो  
इंटेरो लगावी सळी  
करवी.

गज्यानुं नाम : टेकनीकल आसिस्टन्ट

योजनानुं नाम: Evaluation of bioefficacy and phytotoxicity of BAS 750 02 F 400 g/l SC against rust, early leaf spot and late leaf spot diseases of Groundnut.

अजेट सदर (B. H.): 18014-31

१.	अरखकर्तानुं पूरो नाम	:	अटक	नाम	पिता/पतिनुं नाम	
२.	डालनुं सरनामुं	:				
				पीन कोड नं.		
				मोबाईल नं.		
३.	गजन्म तारीख आंकडामां	:				
	उमर (ता. २८/०८/२०१७) ना रोज	:				
४.	अति: अनु. अति/अनु. गजन्म/सा.शे.प.वर्ग/शा.पो.प्रां/सामान्य वर्ग (जे लोय ते स्पष्ट दर्शावतुं तथा अनामत वर्गना उमेदवारो आधारी जोडवा).	:				
५.	शैक्षणिक बायकात अंगेनी माळिती: (प्रमाणपत्रोनी स्वप्रमाणीत नकलो सामेल करवी इरखयात रळेशे)					
	क्रम	परीक्षानुं नाम	युनीवर्सिटी/संस्थानुं नाम	परीक्षा पास कर्यानुं वर्ष	मेगवेल वर्ग ग्रेड/टका	विषय
		१	२	३	४	५
		१				
		२				
		३				
		४				
६.	अनुभवनी विगत (गज्जर गज्याय तो अलग कागण जोडवा) (प्रमाणपत्रोनी स्वप्रमाणीत नकलो सामेल करवी इरखयात रळेशे)					
	क्रम	अनुभव वाणा लोडानुं नाम	क्यांथी क्यां सुधी	कुल अनुभव	पेडी/कंपनी/संस्थानी विगत	
				वर्ष	मास	दिवस
		१				
		२				
		३				
६.	अन्य शैक्षणिक सङ्गता अथवा विशिष्टता जो कोर्ण लोय तो:					

--: जांखेधरी:-

उपरोक्त तमाम विगतो संपूर्ण साची छे, जेमां कोर्णपल प्रकारनी भूलनो अवकाश नथी, आम छतां ते पैकीनी कोर्ण माळितीभोटी पुरवार थाय के असल प्रमाणपत्र साथे यकासता विसंगतता उभी थाय तो मारी उमेदवारी/पसंदगी /निमागुंक "रद्द" थवाने पत्र रळेशे, जे अंगे तुं कोर्णपल प्रकारनो दावो करी शकीश नळि.

स्थण:.....

तारीख:.....

उमेदवारनुं नाम तथा सळी





વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ  
કૃષિ મહાવિદ્યાલય  
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ - ૩૬૨ ૦૦૧  
ફોન નં. (૦૨૮૫)૨૬૭૨૦૮૦ - ૯૦ એક્સ્ટે.૩૦૩/૪૦૩/૩૫૫  
વોક ઈન ઈન્ટરવ્યુ માટેનું અરજી પત્રક  
(તા. ૨૯/૦૮/૨૦૧૭ ના અન્વયે)

તાજેતરમાં પડાવેલ  
પાસપોર્ટ સાઈઝનો  
ફોટો લગાવી સહી  
કરવી.

જાગ્યાનું નામ : ટેકનીકલ આસિસ્ટન્ટ

યોજનાનું નામ: Evaluation of bioefficacy and phytotoxicity of BAS 751 04 F 240 g/l EC against rust, early leaf spot and late leaf spot diseases of Groundnut.

બજેટ સદર (B. H.): 18014-32

૧.	અરજીકર્તાનું પૂરું નામ	:	અટક	નામ	પિતા/પતિનું નામ	
૨.	હાલનું સરનામું	:				
				પીન કોડ નં.		
				મોબાઈલ નં.		
૩.	જન્મ તારીખ આંકડામાં	:				
	ઉમર (તા. ૨૯/૦૮/૨૦૧૭) ના રોજ	:				
૪.	જાતિ: અનુ. જાતિ/અનુ. જનજાતિ/ સા.શૈ.પ.વર્ગ/ શા.ખો.ખા/ સામાન્ય વર્ગ (જે હોય તે સ્પષ્ટ દર્શાવવું તથા અનામત વર્ગના ઉમેદવારોએ આધારો જોડવા).	:				
૫.	શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી: (પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત નકલો સામેલ કરવી ફરજિયાત રહેશે)					
	ક્રમ	પરીક્ષાનું નામ	યુનિવર્સિટી/સંસ્થાનું નામ	પરીક્ષા પાસ કર્યાનું વર્ષ	મેગવેલ વર્ગ ગ્રેડ/ટકા	વિષય
		૧	૨	૩	૪	૫
		૧				૬
		૨				૭
		૩				
		૪				
૬.	અનુભવની વિગત (જરૂર જણાય તો અલગ કાગળ જોડવો) (પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત નકલો સામેલ કરવી ફરજિયાત રહેશે)					
	ક્રમ	અનુભવ વાળા હોદ્દાનું નામ	ક્યાંથી ક્યાં સુધી	કુલ અનુભવ	પેટ્ટી/કંપની/સંસ્થાની વિગત	
				વર્ષ	માસ	દિવસ
		૧				
		૨				
		૩				
૬.	અન્ય શૈક્ષણિક સફળતા અથવા વિશિષ્ટતા જો કોઈ હોય તો:					

-:: બાંહેધરી::-

ઉપરોક્ત તમામ વિગતો સંપૂર્ણ સાચી છે, જેમાં કોઈપણ પ્રકારની ભૂલનો અવકાશ નથી, આમ છતાં તે પૈકીની કોઈ માહિતીખોટી પુરવાર થાય કે અસલ પ્રમાણપત્ર સાથે ચકાસતા વિસંગતતા ઉભી થાય તો મારી ઉમેદવારી/ પસંદગી /નિમણુંક "રદ્" થવાને પત્ર રહેશે, જે અંગે હું કોઈપણ પ્રકારનો દાવો કરી શકીશ નહિ.

સ્થળ:.....

તારીખ:.....

ઉમેદવારનું નામ તથા સહી



વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ  
કૃષિ મહાવિદ્યાલય  
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ - ૩૬૨ ૦૦૧  
ફોન નં. (૦૨૮૫)૨૬૭૨૦૮૦ - ૯૦ એક્સ્ટે.૩૦૩/૪૦૩/૩૫૫  
વોક ઈન ઈન્ટરવ્યુ માટેનું અરજી પત્રક  
(તા. ૨૯/૦૮/૨૦૧૭ ના અન્વયે)

તાજેતરમાં પડાવેલ  
પાસપોર્ટ સાઈઝનો  
ફોટો લગાવી સહી  
કરવી.

જગ્યાનું નામ : ટેકનીકલ આસિસ્ટન્ટ

યોજનાનું નામ: Evaluation of Rallis fungicides pre mixture, Taqut 75 % WP for bio efficacy & Phytotoxicity on cumin.

બજેટ સદર (B. H.): 18014-33

૧.	અરજીકર્તાનું પૂર્ણ નામ	:	અટક	નામ	પિતા/પતિનું નામ	
૨.	હાલનું સરનામું	:				
			પીન કોડ નં.			
			મોબાઈલ નં.			
૩.	જન્મ તારીખ આંકડામાં	:				
	ઉમર (તા. ૨૯/૦૮/૨૦૧૭) ના રોજ	:				
૪.	જાતિ: અનુ. જાતિ/અનુ. જનજાતિ/ સા.શૈ.પ.વર્ગ/ શા.ખો.ખાં/ સામાન્ય વર્ગ (જે હોય તે સ્પષ્ટ દર્શાવવું તથા અનામત વર્ગના ઉમેદવારોએ આધારો જોડવા).	:				
૫.	શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી: (પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત નકલો સામેલ કરવી ફરજિયાત રહેશે)					
	ક્રમ	પરીક્ષાનું નામ	યુનીવર્સિટી/સંસ્થાનું નામ	પરીક્ષા પાસ કર્યાનું વર્ષ	મેગવેલ વર્ગ ગ્રેડ/ટકા	વિષય
						મુખ્ય
						ગૌણ
	૧	૨	૩	૪	૫	૬
	૧					
	૨					
	૩					
	૪					
૬.	અનુભવની વિગત (જરૂર જણાય તો અલગ કાગળ જોડવો) (પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત નકલો સામેલ કરવી ફરજિયાત રહેશે)					
	ક્રમ	અનુભવ વાળા હોદ્દાનું નામ	ક્યાંથી ક્યાં સુધી	કુલ અનુભવ	પેટી/કંપની/સંસ્થાની વિગત	
				વર્ષ	માસ	દિવસ
	૧					
	૨					
	૩					
૬.	અન્ય શૈક્ષણિક સફળતા અથવા વિશિષ્ટતા જો કોઈ હોય તો:					

-:: બાંહેધરી:-

ઉપરોક્ત તમામ વિગતો સંપૂર્ણ સાચી છે, જેમાં કોઈપણ પ્રકારની ભૂલનો અવકાશ નથી, આમ છતાં તે પૈકીની કોઈ માહિતી ખોટી પુરવાર થાય કે અસલ પ્રમાણપત્ર સાથે ચકાસતા વિસંગતતા ઉભી થાય તો મારી ઉમેદવારી/ પસંદગી /નિમણુંક "રદ" થવાને પત્ર રહેશે, જે અંગે હું કોઈપણ પ્રકારનો દાવો કરી શકીશ નહિ.

સ્થળ:.....

તારીખ:.....

ઉમેદવારનું નામ તથા સહી



વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ  
કૃષિ મહાવિદ્યાલય  
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ - ૩૬૨ ૦૦૧  
ફોન નં. (૦૨૮૫)૨૬૭૨૦૮૦ - ૯૦ એક્સટે.૩૦૩/૪૦૩/૩૫૫  
વોક ઈન ઈન્ટરવ્યુ માટેનું અરજી પત્રક  
(તા. ૨૯/૦૮/૨૦૧૭ ના અન્વયે)

તાજેતરમાં પડાવેલ  
પાસપોર્ટ સાઈઝનો  
ફોટો લગાવી સહી  
કરવી.

જગ્યાનું નામ : ટેકનીકલ આસિસ્ટન્ટ

યોજનાનું નામ: Efficacy evaluation of Nativo on cumin blight against alteranaria blight and powdery mildew disease in cumin

બજેટ સદર (B. H.): 18014-34

૧.	અરજીકર્તાનું પૂરું નામ	:	અટક	નામ	પિતા/પતિનું નામ	
૨.	હાલનું સરનામું	:				
			પીન કોડ નં.			
			મોબાઈલ નં.			
૩.	જન્મ તારીખ આંકડામાં	:				
	ઉમર (તા. ૨૯/૦૮/૨૦૧૭) ના રોજ	:				
૪.	જાતિ: અનુ. જાતિ/અનુ. જનજાતિ/ સા.શૈ.પ.વર્ગ/ શા.ખો.ખાં/ સામાન્ય વર્ગ (જે હોય તે સ્પષ્ટ દર્શાવવું તથા અનામત વર્ગના ઉમેદવારોએ આધારો જોડવા).	:				
૫.	શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી: (પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો સામેલ કરવી ફરજિયાત રહેશે)					
	ક્રમ	પરીક્ષાનું નામ	યુનીવર્સિટી/સંસ્થાનું નામ	પરીક્ષા પાસ કર્યાનું વર્ષ	મેળવેલ વર્ગ ગ્રેડ/ટકા	વિષય
	૧	૨	૩	૪	૫	મુખ્ય ગૌણ
	૧					
	૨					
	૩					
	૪					
૬.	અનુભવની વિગત (જરૂર જાણાય તો અલગ કાગળ જોડવો) (પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો સામેલ કરવી ફરજિયાત રહેશે)					
	ક્રમ	અનુભવ વાળા હોદ્દાનું નામ	ક્યાંથી ક્યાં સુધી	કુલ અનુભવ	પેટ્ટી/કંપની/સંસ્થાની વિગત	
				વર્ષ	માસ	દિવસ
	૧					
	૨					
	૩					
૬.	અન્ય શૈક્ષણિક સફળતા અથવા વિશિષ્ટતા જો કોઈ હોય તો:					

--: બાંહેધરી:--

ઉપરોક્ત તમામ વિગતો સંપૂર્ણ સાચી છે, જેમાં કોઈપણ પ્રકારની ભૂલનો અવકાશ નથી, આમ છતાં તે પૈકીની કોઈ માહિતીખોટી પુરવાર થાય કે અસલ પ્રમાણપત્ર સાથે ચકાસતા વિસંગતતા ઉભી થાય તો મારી ઉમેદવારી/ પસંદગી /નિમાણુંક "રદ્" થવાને પત્ર રહેશે, જે અંગે તું કોઈપણ પ્રકારનો દાવો કરી શકીશ નહિ.

સ્થળ:.....

તારીખ:.....

ઉમેદવારનું નામ તથા સહી